

લાખોમાં એક એવું બ્રેમ્પટન સીટી બજેટ લઈ આવ્યું શૂન્ય ટકાનો કર વધારો: લગભગ 20 વર્ષોમાં સૌથી નીચો

બ્રેમ્પટન, ઓન્ટારિયો (27 માર્ચ 2019) – આજે કાઉન્સિલે સર્વસંમતિથી શૂન્ય ટકાના સરેરાશ કર પરિવર્તન સાથેના બ્રેમ્પટનના 2019 અંદાજપત્રને બહાલી આપી જે 20 વર્ષમાં સૌથી નીચો ગણી શકાય.

બ્રેમ્પટનનાં 2019-2021 અંદાજપત્રમાં નીચેના મુખ્ય મુદ્દાઓનો સમાવેશ થાય છે: ની બસોની ફ્લીટમાં 16 ટકાનો વધારો કરવો જેથી ભીડ થતી ઘટાડી શકાય, ક્રિસ ગિબ્સન (Chris Gibson) અને ચિંગ્વુકુઝી વેલનેસ સેન્ટર (Chinguacousy Wellness Centre) સહિત અનેક રિક્રિએશન સેન્ટરોનું પુનરુત્થાન કરવું અને આર્થિક ક્ષેત્રોને પ્રોત્સાહિત કરવા નવો કમ્યુનિટી ઇમ્પ્રૂવમેન્ટ પ્રોગ્રામ.

બહાલી આપવામાં આવેલ અંદાજપત્રથી 2019માં મિલકત વેરામાં એકંદરે 1.1 ટકાનો વધારો પરિણમશે. આમાં સામેલ છે સીટી દ્વારા થયેલ વેરાના પરિવર્તનો (શૂન્ય ટકા), રિજન ઓફ પીલ (1.1 ટકા વધારો) અને સ્કૂલ બોર્ડ્સ (શૂન્ય ટકા).

વેરામાં શૂન્ય ટકાનો સરેરાશ વધારો સેવાઓ ઘટાડીને નહીં પરંતુ કેટલાક મહત્વપૂર્ણ પરિબળોથી સંભવ બન્યો જે 2018 ના વર્ષમાં અપૂર્વ હતાં એમ કહી શકાય. સંસ્થાકીય કાર્યક્ષમતાઓ અને મહેસૂલમાં અસાધારણ વૃદ્ધિથી સીટી આ લાભ કરદાતાઓ સુધી પહોંચાડી શક્યા. આ પરિબળો અને સાથે ફેડરલ સરકારની નગરપાલિકાઓને ગેસ ટેક્સ ફંડિંગ બમાણું કરવાની પ્રતિબદ્ધતાથી 2019-2021ના અંદાજપત્રમાં નાણાં મહત્વપૂર્ણ વ્યુહાત્મક રોકાણોમાં પુનઃ ફાળવવામાં મદદ મળી શકી.

2019-2021 અંદાજપત્રના મુખ્ય મુદ્દાઓ (Budget Highlights)

1. જીવનની ગુણવત્તા સુધારવા બાબત

- ત્રણ વર્ષમાં 46 પ્રણાલીગત બસો અને 25 ઝૂમ (Züm) બસોનો ઉમેરો કરવો
- વરિષ્ઠો માટે એક નવો \$15 માસિક ટ્રાન્ઝિટ પાસ
- નોર્થવેસ્ટ બ્રેમ્પટન ખાતે નવું બંબાખાનું (ફાયર સ્ટેશન) બાંધવું, અગ્નિશમનના સાધનો અદ્યતન કરવા જેથી વધુ વિશ્વસનીય પ્રતિભાવ આપતા દળનું નિર્માણ થઈ શકે
- ક્રિસ ગિબ્સન (Chris Gibson), હાવડન (Howden) અને બાલમોરલ રિક્રિએશન સેન્ટરોનો (Balmoral Recreation Centres) પુનરુદ્ધાર કરવો: ચિંગ્વુકુઝી વેલનેસ સેન્ટરને (Chinguacousy Wellness Centre) અદ્યતન કરવું; રિવરસ્ટોન ગોલ્ફ ક્લબને (Riverstone Golf Club) 34,000 ચોરસ ફૂટના કમ્યુનિટી સેન્ટર તરીકે રૂપાંતરિત કરવું
- સામુદાયિક સુરક્ષા કાર્યક્રમની પહેલોને અનુલક્ષીને જાહેર સુરક્ષા પરિયોજના (Public Safety Project) નો પ્રારંભ કરવો

2. આપણા અર્થતંત્રની વૃદ્ધિ બાબતે

- બ્રમ્પટનનો આર્થિક વિકાસ માસ્ટર પ્લાનમાં ટકિલા આર્થિક ક્ષેત્રોને પ્રોત્સાહિત કરવા નવો માર્કેટિંગ એન્ડ ફોરિન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI) પ્રોગ્રામ અને કમ્યુનિટી ઇમ્પ્રૂવમેન્ટ પ્રોગ્રામનું સર્જન કરવું
- ઇનોવેશન અને કનેક્ટેડ લર્નિંગ માટેનાં સેન્ટરની સ્થાપના તરફ કામ કરવું
- [રિવરવોક](#) પરિયોજના માટે પર્યાવરણીય આકારણી અને અર્બન ડિઝાઇન માસ્ટર પ્લાનનો અમલ કરવો

3. એક સુશાસિત શહેર હોવાથી

- અગાઉના વેરા બિલોમાં જે હોસ્પિટલ લેવિ વસૂલવામાં આવતી તે હવે લગભગ પૂર્ણ થઈ ચુકી છે અને ભેગી કરવામાં આવેલ રકમ પીલ મેમોરિયલ સેન્ટરના તબક્કા 2 માટે ઉપલબ્ધ કરાશે.
- સમારકામ થયેલ હાલતમાં માર્ગો, કમ્યુનિટી સેન્ટરો અને અન્ય અસ્કયામતોને જાળવી રાખવામાં આવે તે માટે બે ટકા ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવિ ચાલુ રાખવામાં આવશે.
- ટ્રાન્ઝિટની વૃદ્ધિ માટેની ભાવિ જરૂરિયાતો માટેના ભંડોળ માટે સમર્પિત, સ્થિર સ્ત્રોત પૂરો પાડવા માટે એક ટકો વેરો દાખલ કરવામાં આવ્યો.
- અંદાજપત્રમાં સંબંધિત લેવિઓને વાણી લેવામાં આવી છે જેથી સીટીના હિસ્સાના વેરા બિલમાં શૂન્ય ટકાનો સરેરાશ વધારો આપી શકાય.

લિંક:

[ટર્મ ઓફ કાઉન્સિલ પ્રાયોરિટીઝ \(Term of Council Priorities\) અને બ્રમ્પટન 2040 વિઝન](#)

[સીટી ઓફ બ્રમ્પટનનું બજેટ વેબપેજ \(City of Brampton's Budget webpage\)](#)

ક્વોટ:

"આ કાઉન્સિલ તેઓનું પ્રથમ અંદાજપત્ર સીટીના હિસ્સામાં વેરાના કોઈ વધારા વિના અને ઉચ્ચ ગુણવત્તાના પ્રોગ્રામ્સ અને સેવાઓ પ્રદાન કરવામાં કોઈ તડબોડ કર્યા વિના રજૂ કરવામાં ગૌરવની લાગણી અનુભવે છે. અમે ટ્રાન્ઝિટમાં મોટા રોકાણો કરી રહ્યા છીએ અને આર્થિક વિકાસની તકો ઊભી કરી રહ્યા છીએ. જેમજેમ બ્રમ્પટન 2040 વિઝનને નજર સામે રાખીને વધુ પ્રગતિ કરશે તેમ તેમ ભવિષ્યના વર્ષોમાં અવિરત રોકાણોની જરૂર પડશે જેથી આપણી ઝડપથી વધી રહેલ વસ્તીની વધતી જતી જરૂરિયાતોને પૂર્ણ કરી શકાય.

- મેયર પેટ્રિક બ્રાઉન (Mayor Patrick Brown), અંદાજપત્ર સમિતિના પ્રમુખ (Chair of Budget Committee)

"2019-2021 અંદાજપત્રને આકાર આપવામાં સમાજમાંથી આવેલ પ્રતિભાવો અતિ મહત્વના ઠર્યા અને અમે અપણા નાગરિકો અને વેપારી પેઢીઓના ઋણી છીએ કે તેઓએ બ્રમ્પટનના વિકાસમાં સક્રિય રસ લીધો. સ્થિતિસ્થાપક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઉચ્ચ માધ્યમિક શિક્ષણ, ટ્રાન્ઝિટના

કનેકશનોની પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્રોમાં ટર્મ ઓફ કાઉન્સિલ પ્રાયોરિટીઝના વિકાસાર્થે અમે સરકારમાં ઉચ્ચ સ્તરે પણ કાર્ય કરવું ચાલુ રાખીશું, જે તમામ મુદ્દાઓ બ્રેમ્પટનમાં વ્યાપારને આકર્ષિત કરવા માટે અગત્યના છે.

- રિજનલ કાઉન્સિલર પૉલ વિસેન્ટ, અંદાજપત્ર સમિતિના ઉપપ્રમુખ (*Regional Councillor Paul Vicente, Vice-Chair of Budget Committee*)

"હું સ્ટાફનો આભારી છું કે તેઓએ વિકાસના પડકારો નવતર માર્ગો અપનાવીને ઝીલ્યા અને આવા ઐતિહાસિક અંદાજપત્રને રજૂ કરવા માટે સંસ્થાકીય અને નાણાકીય કાર્યક્ષમતાઓ શોધી કાઢી. એક સારી નાણાકીય સ્થિતિ અને સરસ આયોજનથી કેટલીક રાહત કરદાતાઓ સુધી પહોંચાડી શક્યા. કેનેડાના અને તે ઉપરાંત, એક મુખ્ય શહેરના સર્જનના ભાગરૂપે પોતાની ભૂમિકાને બ્રેમ્પટન વેગ આપી રહ્યું છે ત્યારે વિકાસના દબાણો ઓછા નહીં થાય અને અમે યોગ્ય રોકાણો કરવા ચાલુ રાખીશું જેથી આપણો વિકાસ અને સુધારા થયા કરે.

- જો પિટ્ટારી, કાર્યવાહક મુખ્ય વહીવટી અધિકારી (*Joe Pittari, Acting Chief Administrative Officer*)

-30-

સીટી ઓફ બ્રેમ્પટન વિશે વિષે વધુ માહિતી માટે અહીં મુલાકાત લો www.brampton.ca અમને ફોલો કરો [Twitter](https://twitter.com/brampton) પર, [Facebook](https://www.facebook.com/brampton) પર, અને [Instagram](https://www.instagram.com/brampton) પર.

મિડિયા સંપર્ક:

મોનિકા દુગ્ગલ

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રેમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca